

ત્વરિત જાહેરાત માટે

કેનેડાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રેમ્પટનમાં યોજવાની છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 4, 2019) – સીટી ઓફ બ્રેમ્પટન આ ઘોષણા કરતા રોમાંચ અનુભવે છે કે તેઓ ઉનાળો 2019 માં ગ્લોબલ (વૈશ્વિક) T20 (GT20) ક્રિકેટ ટુર્નામેન્ટના યજમાન બનશે!

GT20 એક વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેમાં ઉત્તર અમેરિકી ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટની દુનિયાના કેટલાક સૌથી મોટા નામો ભાગ લેશે.

આ ટુર્નામેન્ટની પહેલી સીઝન જૂન 2018 માં કિંગ સીટી, ઓન્ટેરિયોમાં શરૂ થઈ, અને બીજી સીઝન જુલાઈ 25 થી ઓગસ્ટ 11, 2019 સુધી યોજાશે.

GT20 એ કેનેડામાં યોજનારી પહેલી મોટી T20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે, અને તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકો ખેંચી લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

બ્રેમ્પટનમાં આ શહેરની માલિકીના 12 મોટા ક્રિકેટ મેદાનો અને ચાર નાના કદના મેદાનો છે. બ્રેમ્પટનમાં આ રમતની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતા, આ શહેર પાસે 2019 માં ત્રણ મોટા ક્રિકેટ પ્રોજેક્ટ્સનું આયોજન છે. બે નવા પૂર્ણ કદના ક્રિકેટ મેદાનો 407/Dixie area (ડિક્સી વિસ્તારમાં) અને ગૌર મેડોસ કમ્યુનિટી સેન્ટરમાં બંધાઈ રહ્યા છે. વધુમાં, ટેરામોટો પાર્ક ક્રિકેટ ફિલ્ડને LED (એલઈડી) લાઈટો મળવાની છે, જે સમગ્ર મેદાનને આવરી લેશે – કેનેડામાં પૂર્ણ કદના ક્રિકેટ મેદાન માટે તેના પ્રકારનું આ પહેલું મેદાન છે.

GT20 ટુર્નામેન્ટ વિશે વધુ માહિતી મેળવવા, કૃપા કરી વેબસાઈટ જુઓ www.gt20.ca

અવતરણો (ક્વોટ્સ):

“મને એ કહેવામાં ગૌરવ થાય છે કે બ્રેમ્પટન આ વર્ષે GT20 ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બની રહ્યું છે! એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર તરીકે જ્યાં ક્રિકેટ ખાસ કરીને પ્રખ્યાત છે, બ્રેમ્પટન આ પ્રસિદ્ધ આયોજન માટે એક આદર્શ સ્થળ છે. અમે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને લાજર રહેવાનું નિમંત્રણ આપીએ છીએ જે ચોક્કસપણે આ ઉનાળામાં એક રોમાંચક ટુર્નામેન્ટ બની રહેવાની છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“GT20 કેનેડા બ્રેમ્પટનને પોતાનું નવું ઘર બનાવવામાં બહુ રાજી છે. આ ક્રિકેટ માટે વિકસવા અને ફળદ્રુપ થવા એક કુદરતી નિવાસસ્થાન છે, અને અમે વિશ્વસ્તરીય ક્રિકેટ અને શહેરમાં કેટલાક સૌથી મોટા નામો લાવવા પૂરેપૂરા કટિબદ્ધ છીએ. આ શહેરની સહાયતા અને ક્રિકેટ કેનેડાના માર્ગદર્શન વડે, અમે ભવિષ્યમાં કેનેડિયન ક્રિકેટને સેવા આપવા પ્રતિભાઓને પોષવા અને વિશ્વસ્તરીય ક્રિકેટરો ઊપજાવવા પાયાના સ્તરે રોકાણ કરી રહ્યા છીએ. હું અમને અહીં લાવવામાં સીટી ઓફ બ્રેમ્પટન અને મેયર પેટ્રિક બ્રાઉનને કરેલી સહાયતા માટે તેઓનો આભાર માનું છું. સાથે મળીને, આપણે બ્રેમ્પટનને વૈશ્વિક ક્રિકેટ નક્શામાં ઉમેરી શકીએ છીએ.”

- ગુરમીત સિંહ (Gurmeet Singh), માલિક, GT20 કેનેડા

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

મિડિયા સંપર્ક- GT20 ક્રિકેટ ટુર્નામેન્ટ

સ્વપ્નિલ ઠાકરે (Swapnil Thakare)

આસિસ્ટન્ટ મીડિયા મેનેજર, GT20

647.327.0650 | media@gt20.ca